

78 78 5 91 0 92 પર GK લખી વોટ્સેપ પર સેન્ડ કરો.

Current affairs 355 (1) સામાન્ય જ્ઞાન 8-2-2017

Page-1

## રાષ્ટ્રીય

૧) દેશમાં મોબાઈલથી થતા ગુનાઓને રોકવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આદેશ આપેલ છે, કે એક વર્ષમાં તમામ મોબાઈલ ધારકોનું વેરિફિકેશન કરાવે.

૨) પોતાની જાતને સુભાષચંદ્ર બોઝનાં ડ્રાઈવર ગણાવતા નીઝામુદીનનું 116 વર્ષની વયે અવસાન થયેલ છે.

૩) તાજેતરમાં ઉત્તર ભારતમાં આવેલ ભૂકંપનું કેન્દ્રબિંદુ રુદ્રપ્રયાગમાં હતું. આ ભૂકંપની તીવ્રતા 5.8 રીક્ટર સ્કેલની હતી.

૪) કૈલાશ સત્યાર્થીનું નોબલ પ્રાઈઝ પોતાના ઘેરેથી ચોરાઈ ગયેલ છે.

## આંતરરાષ્ટ્રીય

૫) ચીનના ઘર આંગણે તૈયાર થયેલ દેશનું સૌથી મોટું પેસેન્જર પ્લેન ચાલુ વર્ષે ઉડાન ભરશે.

૬) તાજેતરમાં ચીનની રોકેટ ફોર્સ ટીમે 1000 કિમીથી વધુની રેંજ ધરાવતી મીડીયમ રેંજ બેલેસ્ટિક મિસાઈલ ડોંગફેંગ-16 નું પ્રદર્શન કરેલ છે.

૭) સ્લોવેકીયા દેશના વૈજ્ઞાનિકોનો એવો દાવો છે કે તેઓએ વિશ્વની સૌથી જૂની ઈમોજી શોધી કાઢી છે.

૮) 7 ફેબ્રુઆરી 1992 ના રોજ યુરોપના સચુંકત ચલણ માટેની સંધી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

૯) લંડનની ઈમ્પીરીયલ કોલેજના સંશોધકોએ (ઉચ્છવાસ) ટેસ્ટ દ્વારા કેન્સરનું નિદાન થઈ શકે તેવું મશીન બનાવેલ છે.

## રમત-જગત

૧૦) બી.સી.સી.આઈ.ના મીડિયા મેનેજર તરીકે ફરજ બજાવતા નિશાંત અરોડાએ હાલમાં રાજીનામું આપેલ છે.

8-2-2017

૧૧) અગામી 14 મી ફેબ્રુઆરીથી શરુ થઈ રહેલ એશિયા મિક્સ ટીમ ચેમ્પિયનશીપમાં સીંઘુ તથા સાયના નહેવાલ ભાગ લેશે.

૧૨) મોહનકુમાર મંગલમ ક્રૂટબોલ પ્રતિયોગિતાનું આયોજન ઉદયપુર ખાતે થયેલ છે.

૧૩) હાલમાં કેમરૂન દેશે આફ્રિકન નેશન્સ ક્રૂટબોલ કપ 2017 નો ખિતાબ જીતેલ છે.

૧૪) ઈરાન દેશ અમેરિકી કુશ્તી ટીમને વિઝા આપવા માટે સહમત થયેલ છે.

૧૫) કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં પૈરા એથલીટો માટે પ્રથમ પ્રશિક્ષણ કેન્દ્રનું ખાત મુહૂર્ત કરેલ છે.

૧૬) ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપના ફ્રસ્ટ રાઉન્ડમાં ગ્રેટ બ્રિટન અને સ્પેને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

૧૭) આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહાસંઘ દ્વારા મહિલા એશિયાકપ અને એફ.આઈ.બી.એ.અન્ડર-16 મહિલા એશીયાકપ 2017 ની મેજબાની ભારતને સોંપેલ છે.

૧૮) ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના સુકાની કેપ્ટન કુકે તેની ટીમ ભારત સામે પરાજિત થતા પોતાના પદ પરથી રાજીનામું આપેલ છે.

**અન્ય**

૧૯) NATA નું પુરુનામ થાય છે, નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર થાય છે.

૨૦) જીવન વીમા નિગમ તેના એજન્ટોને 2 લાખની જગ્યાએ ત્રણ લાખ ગ્રેચ્યુઈટી આપશે.

8-2-2017

## સમીક્ષા 192(1) તારીખ 8/2/2017

### વયોવૃદ્ધ સ્વતંત્રતા સેનાની રાયર્લા સામ્રાજ્યનું અવસાન થયું...

- ૧) સ્વતંત્રતા સેનાની રાયર્લા સામ્રાજ્યનું 6 ફેબ્રુઆરી 2017 ના રોજ અવસાન થયેલ છે, તેઓ 98 વર્ષની વયના હતા.
- ૨) તેઓએ વર્ષ 1942 માં અનંતપુરમાં હિન્દી પ્રચારક પ્રશિક્ષણ કાર્યક્રમ દરમિયાન ભારત છોડો આંદોલનથી પ્રભાવિત થઈને સ્વતંત્રતા આંદોલનમાં ઝંપલાવ્યું હતું.
- ૩) સ્વતંત્રતા સેનાની રાયર્લા સામ્રાજ્યનો જન્મ 1919 માં આંધ્રપ્રદેશના ગોપારાજુ વેંકટ સુબ્બારાવ અને રાજ્યલક્ષ્મીના ઘેરે થયો હતો.
- ૪) ભારત છોડો આંદોલન વખતે તેઓને બેજાવાડા જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા.
- ૫) જી દુર્ગાબાઈની શિક્ષાથી પ્રભાવિત થઈને તેમણે 1945 માં ગ્રામીણ વિકાસ કાર્યક્રમોમાં ભાગ લેવાની શરૂઆત કરી.
- ૬) સ્વતંત્રતા સેનાની રાયર્લા સામ્રાજ્યએ ગોદાવરી જિલ્લાના સીતાગ્રામમાં વિવિધ સામાજિક કાર્યો કરેલ.
- ૭) સ્વતંત્રતા સેનાની રાયર્લા સામ્રાજ્યને કેન્દ્ર સરકાર દ્વારા 1972 માં તામ્રપત્રથી સન્માનિત કર્યા હતા.

– પરેશ ચાવડા

8-2-2017

રોજે- રોજ આપના ફોનમાં જુકે, કરંટ અફેર્સ મેળવવા નીચેની લીંક પરથી એપ ડાઉનલોડ કરો.

<https://play.google.com/store/apps/details?id=com.edusafar>

વિડીયો ઘોરણ 10 પ્રકરણ 14 ના મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન વિડીયો જુઓ નીચેની લિંક પરથી

<https://www.youtube.com/watch?v=a292hPWbE20>

ગણિત સાદું વ્યાજ વિડીયો ભાગ ચાર.માટે નીચેની લિંક ઓપન કરો.

<https://www.youtube.com/watch?v=v9uCYOeeN6A>

28 થી 31 જાન્યુઆરી કરંટ અફેર્સનો ગુજરાતી વિડીયો નીચેની લિંક પરથી જુઓ

<https://www.youtube.com/watch?v=4lmDCO8C4-Y>

બેસ્ટ જુકે વિડીયો માટે નીચેની લીંક ઓપન કરો.

[https://www.youtube.com/channel/UCfDAM9P2RF\\_ynz8B\\_j5enC](https://www.youtube.com/channel/UCfDAM9P2RF_ynz8B_j5enC)

મિત્રો, એજ્યુસફર દ્વારા **GK** ના વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે આ માટે **YouTube** પર જઈ, **EduSafar** લખી સર્ચ કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી **GK** વિડીયો ના નવા અપડેટ્સ મેઈલ પર મળતા રહેશે.